



જાહેરાત ક્રમાંક નં /૨૦૨૦

મેડીકલ ઓફિસર તેમજ પેરા મેડીકલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન વિસ્તારમાં “અર્બન હેલ્થ ક્લિનિક” (સાંજના ૫ થી ૯) માટે મેડીકલ ઓફિસર તેમજ પેરા મેડીકલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ ગોઠવાના થાય છે. જે આધારે નીચે દર્શાવેલ જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે.

ક્રમ	જગ્યાનું નામ	શૈક્ષણિક લાયકાત	જગ્યા	ઉંમર	ઉચ્ચક માસિક વેતન
૧	મેડીકલ ઓફિસર	<ul style="list-style-type: none"> <li>ઇન્ડિયન મેડીકલ કાઉન્સિલ દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી એમ.બી. બી. એસ. પાસ કરેલું હોવું જોઈએ.</li> <li>ફરજિયાત ઇન્ટર્નશિપ પૂરી કરેલ હોવી જોઈએ.</li> <li>ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ.</li> <li>સ્થાનિક પ્રાઇવેટ પ્રેક્ટીસ કરતા તબીબને પ્રાધાન્ય આપવામાં આવશે.</li> </ul>	૩૫૪	મહત્તમ ૬૨ વર્ષ	રૂ. ૩૦,૦૦૦/-માનદ વેતન
૨	પેરા મેડીકલ સપોર્ટીંગ સ્ટાફ (એ. એન. એમ. -ફક્ત સ્ત્રી ઉમેદવાર અથવા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર અથવા સ્ટાફ નર્સ)	<ul style="list-style-type: none"> <li>એ. એન. એમ.               <ol style="list-style-type: none"> <li>ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી એ. એન. એમ./એફ. એચ. ડબલ્યુ</li> <li>ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ.</li> </ol> </li> <li>મલ્ટી પરપઝ હેલ્થ વર્કર               <ol style="list-style-type: none"> <li>એસ.આઇ.ડીપ્લોમા અથવા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર કોર્સ પાસ.</li> </ol> </li> <li>સ્ટાફ નર્સ               <ol style="list-style-type: none"> <li>ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી).નર્સિંગ(ની ડીગ્રી ધરાવતા હોવા જોઈએ.</li> </ol> <p style="text-align: center;">અથવા</p> <ol style="list-style-type: none"> <li>જનરલ નર્સિંગ અને મીડવાઇફરીનો ડિપ્લોમા ધરાવનાર.</li> </ol> <p style="text-align: center;">અથવા</p> <ol style="list-style-type: none"> <li>મીડવાઇફરીનો ટુંકાગાળાનો કોર્સ કરેલો હોવો જોઈએ.</li> </ol> </li> <li>ધોરણ ૧૨ માં કોમ્પ્યુટર વિષય હોય અથવા બેઝીક કોમ્પ્યુટર સર્ટીફિકેટ ધરાવતા હોવા જોઈએ.</li> </ul>	૩૫૪	મહત્તમ ૪૫વર્ષ	રૂ.૧૦,૦૦૦/- ઉચ્ચક વેતન



## શરતો

1. ઉપરોક્ત જગ્યાઓ રાજ્ય સરકારના સ્ટેટ બજેટ માંથી ફાળવેલ ગ્રાન્ટ હેઠળ ભરવાની થતી હોઈ તમામ જગ્યા માનદ વેતને ભરવાની થાય છે.
  2. ઉપરોક્ત જગ્યા માટે જે તે તબક્કે કોઈપણ પ્રકારનું રાજકીય કે સંસ્થાકીય દબાણ કરવામાં આવશે તો તેઓની નિમણૂક રદ કરવામાં આવશે.
  3. અરજદારે અરજી ફોર્મ સાથે લાયકાત તથા અનુભવનાં તમામ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જોડવાની રહેશે. જો પ્રમાણપત્રની નકલ જોડેલ નહી હોય તો તેવી અરજી રદ ગણવામાં આવશે તેમજ અરજી ફોર્મ ભર્યા બાદ અરજીમાં દર્શાવેલ વિગતોના તથા અરજી સાથે જોડેલ પ્રમાણપત્રના અસલ પુરાવા રજૂ નહી કરે તો અત્રેની ઓફીસેથી લીધેલ નિર્ણય છેલ્લો ગણાશે. તે અંગે ઉમેદવારનો કોઈ હક્ક દાવો રહેશે નહી.
  4. ઉમેદવારનો અનુભવ અસલ પ્રમાણ પત્ર ચકાસણી વખતે અસલ અનુભવનાં પ્રમાણપત્રને આધારે ગણવામાં આવશે તેઓના નિમણૂંક ઓર્ડરને આધારે અનુભવ ગણાશે નહી.
  5. જે ઉમેદવારનાં માર્ક્સ ગ્રેડમાં હોય તેવા ઉમેદવારે જે-તે યુનિવર્સિટીમાંથી ડીગ્રી મેળવી હોઈ તે યુનિવર્સિટીનું ગ્રેડને ટકાવારીમાં ફેરવવા અંગેનો પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે. જો ઉમેદવાર આ અંગેનું પ્રમાણપત્ર રજૂ ના કરે તો તે ઉમેદવાર ના લઘુત્તમ માર્ક્સ ગણાશે.
  6. પસંદગી પામેલ ઉમેદવાર નિમણૂંક અધિકારી ઠરાવે તે શરતોને આધીન નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
  7. આ જગ્યાની ભરતી પ્રકીયાનાં અનુસંધાને આ જાહેરાતમાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ખાતાના ઉચ્ચ અધિકારીને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને ઉચ્ચ અધિકારી આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી.
  8. સીલેક્ટ થયેલ ઉમેદવારની નિમણૂંક ૧૧ માસ માટે રહેશે.
  9. ઉમેદવારની નિમણૂંક અંગે રાજ્ય સરકાર દ્વારા સુધારો સુચવવામાં આવે તો તે મુજબ સક્ષમ સત્તાધિકારીશ્રીની મંજૂરીથી તેમાં સુધારો કરવામાં આવશે.
- રજીસ્ટ્રેશનનો સમય :- સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ કલાકે
  - ઇન્ટરવ્યુની તારીખ :- ૩૦/૦૩/૨૦૨૦
  - ઇન્ટરવ્યુનું સમય :- સવારે ૧૦:૩૦ કલાકથી
  - ઇન્ટરવ્યુનું સ્થળ :- આરોગ્ય અધિકારીશ્રીની રૂમ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, ગીતામંદિર બસ સ્ટોપ પાસે, ગીતામંદિર રોડ, અમદાવાદ

મેમ્બર સેક્રેટરી

ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ